

**મુદ્રા નં. :— ૪૦**  
**વિધવા સહાય મેળવવા બાબત**

૧ અરજ કોનેકરવી : પ્રાંત અધિકારીશ્રીને

૨ નિકાલ માટેના : પ્રાંત અધિકારીશ્રી  
સત્તાધિકારી

૩ નિકાલ માટેની  
સમય મર્યાદા : ૫૦ દિવસ

અરજમાં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી રીતે ભરવાની રહેશે. તેમજ અરજ સાથે માયા મુજબના તમામ પુરાવાઓની પ્રમાણિત નકલ બીડવાની રહેશે. આ ઉપરાંત અરજ સાથે આપેલ ચેકલીસ્ટમાં તમામ મુદ્રાઓના જવાબ અવશ્ય આપવાના રહેશે. જો એક પણ વિગત અધુરી હશે કે પુરાવા રજુ કરેલ નહીં હોય તો અરજપત્રક સ્વીકારવામાં આવશે નહીં.

**અરજ સાથે નીચે મુજબનાં પુરાવાઓની પ્રમાણિત નકલો સામેલ કરવાની રહેશે.**

૧. અરજદારની અરજ (પરિશિષ્ટ-૧/૪૦ મુજબ )
  ૨. સોગંદનામુ (પરિશિષ્ટ ૨/૪૦ મુજબ )
  ૩. આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૪૦ મુજબ )
  ૪. વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૪૦ મુજબ )
  ૫. અરજદારના પતિનો મરણનો દાખલો
  ૬. અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટિફિકેટ આ બનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉમર અંગેનો દાખલો.
  ૭. અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
  ૮. મૈયતના વારસદારોનું પેઢીનામું.
  ૯. અરજદારના રેશનકાર્ડની નકલ
  ૧૦. અરજદારના બાળકોની ઉમરના પુરાવા, જન્મના દાખલા.
  ૧૧. ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાહેઘરી પત્ર.
  ૧૨. પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષ જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
  ૧૩. ૨૧ વર્ષથી વધુ ઉમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે આસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજ સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા.
  ૧૪. અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે.
- અગત્યની નો નોંધ :**
- (૧) વિધવા થયાની તારીખથી બે વર્ષના સમયગાળામાં કરવામાં કરવામાં આવેલ અરજ માન્ય ગણાશે.

પરિશીષણ :— ૧/૪૦  
અરજદારની અરજી

બાર-કોડ સ્ટીકર  
માટેની જગ્યા

અરજદારનો  
તાજેતરમાં  
પડાવેલ  
ફોટો

કોઈ ફી સ્ટેમ્પ  
રૂ.૩/-

પ્રતિ,  
પ્રાંત અધિકારીશ્રી,  
.....

વિષય : વિધવા સહાય મેળવવા અંગે

હું નીચે સહી કરનાર આથી સમાજ સુરક્ષા

વિભાગની ઉપરોક્ત યોજના ડેટા આર્થિક સહાય મેળવવા માટે કરું છું અને તે સબંધમાં નીચેની વિગતો આપું છું. જે મારી જાણ મુજબ સંપૂર્ણ સાચી છે.

૧. પુરુષ નામ : (અટક) નામ  
પતિનું નામ : પિતાનું નામ :
૨. ધર્મ : હિન્દુ / મુસ્લિમ / પારસી / શીખ / અન્ય :
૩. જાતિ : અનુ. જાતિ/અનુ. જનજાતિ/સા.શૈ.પ.વ./અન્ય :  
(લાગુ ન પડતું હોય તો છેકી નાખવું.) શરીર પરના
૪. ઉંમર વર્ષ : જન્મ તારીખ : ઓળખનું નિશાન
૫. પાંકું સરનામું : ઘર નંબર : શેરી : મહોલ્લો :  
ગામ : તાલુકો : જિલ્લો :  
પોસ્ટ ઓફિસ : પીનકોડ નંબર :
૬. ગુજરાત રાજ્યમાં વર્ષથી કાયમી વસવાટ કરું છું.
૭. અરજદારની પોતાની આવક ખેતી, ઉદ્યોગ, નોકરી, ઘરભાડું, વ્યાજ, ડિવિડન્ડ, પેન્શન, આવક વગેરેથી થતી કુલ વાર્ષિક આવક. રૂ.                          અંકે રૂપિયા

કુટુંબના સભ્યોની વિગત તેમજ આર્થિક સ્થિતિ  
(માતા, પિતા, પોતાના કે સાવકા પુત્ર તથા પુત્રીનો પણ જણાવવા.)

કુમ નામ ઉંમર અરજદાર અભ્યાસ આવકનું કુલ વાર્ષિક

સાથે સગપણ સાધન આવક

૧. અરજદાર પોતે

૨.

૩.

૪.

૮. અગાઉ આ યોજના હેઠળ આર્થિક સહાય મેળવેલ છે કે કેમ? તેની વિગત હા/ના.
૯. અરજદારે પોતાની ઉભર તથા તેની સાથે રહેતા બાળકોની ઉભર બાબતે નીચે જણાવેલ દાખલાઓ પૈકી  
ગમે તે એક રજૂ કરવો.
- (૧) શાળાના પ્રમાણપત્રમાં જણાવેલ જન્મ તારીખ.
- (૨) જન્મનો દાખલો.
- (૩) રેશનકાર્ડ અથવા મતદાન યાદીમાં ઉભરનો દાખલો.
- (૪) અન્ય કોઈ દાખલા ન મળે તો ખુનિસિપલ મેડિકલ ઓફીસર અથવા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનું ઉભર અંગેનું પ્રમાણપત્ર.
૧૦. અરજપત્રક સાથે આવકનું પ્રમાણપત્ર આ સાથે જોડેલ નિયમ નમુનામાં તેમાં દર્શાવિલ અધિકારીઓ  
પૈકી કોઈ એક અધિકારી પાસેથી મેળવી રજૂ કરવું.
૧૧. અરજદાર વિધવા હોવા અંગે જે તે તાલુકાના મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રીનું  
પ્રમાણપત્ર તથા પતિના મરણનો દાખલો તલાટીશ્રી પાસેથી મેળવીને રજૂ કરવો.
૧૨. અરજદારને ૨૧ વર્ષથી વધુ ઉભરનો પુત્ર હોય પરંતુ શારિરીક રીતે અપંગ હોય અથવા માનસિક  
રીતે અસ્થિર હોય તેમણે અરજ સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા રજૂ કરવા.
૧૩. અરજદાર પગભર થવા માટે કયા પ્રકારની સરકાર માન્ય તાલીમ લેવા માંગે છે? તાલીમ કઈ  
સરકાર માન્ય સંસ્થા મારફતે લેશો, તેની વિગતો ટૂંકમાં જણાવો. આ અગાઉ કોઈ તાલીમ મેળવેલ  
છે? અથવા  
કોઈ ધંધો શરૂ કરવા ઈચ્છે છે? હા, તો કયો ધંધો તેના માટેનો અનુભવ છે?

સ્થળ :

તારીખ :

.....  
અરજદારની સહી / નામ / અંગુઠાનું નિશાન

**સુચના:** આ અરજપત્રક જે તે પ્રાંત અધિકારીશ્રીની કચેરીને મોકલવાનું રહેશે. આ યોજના નીચે ૧૮ થી  
૪૦ વર્ષની ઉભર અને ૪૦ થી ૭૦ વર્ષ અને ૫૦ વર્ષ સુધીની ઉભરની નિરાધાર વિધવા જેમને પુખ્ત  
ઉભરનો પુત્ર ન હોય, જેમની વાર્ષિક વ્યક્તિગત આવક રૂ.૨,૪૦૦/- થી વધુ ન હોય અથવા  
સમગ્ર કુટુંબની આવક રૂ.૪,૫૦૦/- થી વધુ ન હોય અને ગુજરાત રાજ્યમાં રહેતા હોય તેઓ  
અરજ કરવાને પાત્ર છે.

**ચેકલીસ્ટ (મુદ્દા નં-૪૦)**  
**વિધવા સહાય મેળવવા બાબત**

(અરજદારે અરજસાથે રજુ કરવાનું રહેશે)

અં.ન	વિગત	હા/ના લાગુ પડતુનથી	પાન નંબર
૧	અરજપત્રક (પરિશિષ્ટ-૧/૪૦)		
૨	નિયત કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલ છે?		
૩	સોંદનામુ (પરિશિષ્ટ ૨/૪૦)		
૪	આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૪૦)		
૫	વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૪૦)		
૬	અરજદારના પતિનો મરણનો દાખલો		
૭	અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિલીગ સર્ટીફિકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબ અધિકારીશ્રીનો ઉમર અંગેનો દાખલો.		
૮	અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.		
૯	મૈયતના વારસદારોનું પેઢીનામું.		
૧૦	અરજદારના રેશનકાર્ડની નકલ		
૧૧	અરજદારના બાળકોની ઉમરના પુરાવા, જન્મના દાખલા.		
૧૨	૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.		
૧૩	પુનઃ લઘુ કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષ જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)		
૧૪	૨૧ વર્ષથી વધુ ઉમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજ સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા.		
૧૫	બાર-કોડ સ્ટીકર લગાવેલ છે?		

સ્થળ :

.....

તારીખ :

અરજદારની સહી / નામ

નોંધ: ચેકલીસ્ટના કોલમ નં.૩ માં "હા/ના અથવા લાગુ પડતુનથી" તેમ સ્પષ્ટ દર્શાવવું તથા સામેલ કરેલ પુરાવા ક્યા પાન નંબર ઉપર છે તે પણ દર્શાવવું. આ પૈકીના એક પણ મુદ્દાની પૂર્તતા બાકી હશે તો અરજ પત્રક સ્વીકારવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવી.

અરજ પત્રક સ્વીકાર્ય

.....  
 જન સેવા કેન્દ્ર ફરજ પરના  
 કર્મચારીની સહી / નામ / સિક્કો / તારીખ

**પરિશિષ્ટ :—૨/૪૦**  
**સોગંદનામું**

આથી હું નીચે સહી કરનાર મારા ધર્મ પ્રમાણે સોગંદ લઈ એકરાર કરું છું કે ઉપરોક્ત હકીકત સંપૂર્ણ સત્ય છે અને તેમાં કોઈ ફેરફાર ભવિષ્યમાં થશે તો તેની જાણ કરવા બંધાઉ છું. ખોદું સોગંદનામું કરવું તે ફોજદારી ગુન્ધો બને છે તેની સમજ મને મળી છે. હું નિયત સમયમાં સરકાર માન્ય તાલીમ સંસ્થામાં જોડાઈ તેની જાણ કરીશ. જો તેમ ન થાય તો મારી આર્થિક સહાય બંધ કરવા ખાત્રી આપું છું. અરજદારે અમારી રૂબરૂ સહી અથવા અંગુઠાનું નિશાન કરેલ છે.

સ્થળ : .....  
તારીખ : .....  
સાક્ષીઓ સહી નામ અને પુરું સરનામું

અરજદારની સહી / નામ / અંગુઠાનું નિશાન

૧.

૨.

રૂબરૂ

તલાટી ગ્રામ પંચાયત  
કસબા

## પરિશિષ્ટઃ—૩/૪૦

### આવક અંગેનું પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, મારી જાણ તથા માન્યતા મુજબ નિરાધાર વિધવા અરજદાર રહેવાસી તાલુકો જિલ્લો ની વ્યક્તિગત/કૌટુંબિક આવક નીચે મુજબ છે.

- (૧) અરજદારની પોતાની સને વર્ષની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. અંકે રૂપિયા છે.
  - (૨) અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક સને વર્ષની કુલ રૂ. અંકે રૂપિયા છે.  
ઉપર્યુક્ત આવક નીચેના સ્ત્રોતમાંથી થાય છે. તેની અમોઅની / ખાત્રી કરાવી આ પ્રમાણપત્ર આપેલ છે.
  - (૩) ખેતી (૪) ઉદ્યોગ (૫) સ્થાવર/જગમ ભિલકતમાંથી ભાડું (૬) વ્યાજની આવક (૭) ડીવીડન્ડ  
(૮) પેન્શન (૯) ઘરભાડું (૧૦) અન્ય.
- આવકના સાધનની વિગત ટૂંકમાં

સહી :

મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી  
તાલુકો –

ઉપરોક્ત આવક અંગેનું પ્રમાણપત્ર મામલતદાર/તાલુકા વિકાસ અધિકારીશ્રી પાસેથી મેળવી રજૂ કરવાનું રહેશે.

**પરિશિષ્ટ : -૪/૪૦**  
**વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર**

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે અરજદાર રહે તાલુકા જિલ્લો એ નિરાધાર વિધવા આર્થિક સહાય યોજના હેઠળ અરજી કરેલ છે તેણી વર્ષ માસથી વિધવા મહિલા છે. તેણી એ વિધવા સહાય લેવા અંગે મારી સમક્ષ રજુ કરેલ પુરાવા/વિગતો મેં ચકાસણી કરેલ છે. અને તેણી વિધવા નિરાધાર મહિલા છે. તેની મને ખાત્રી થઈ છે. સમાજ સુરક્ષા ખાતાની નિરાધાર વિધવા મહિલાની પુનઃવસવાટ યોજના તળે આર્થિક સહાય મંજુર કરવા ભલામણ કરૂ છું

સ્થળ :

તારીખ :

તાલુકો –

સહી :

મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી

ઉપરોક્ત પ્રમાણપત્ર મામલતદાર/તાલુકા વિકાસ અધિકારીશ્રી પાસેથી મેળવી રજુ કરવાનું રહેશે.